

13 સપ્ટેમ્બર 2018

તાજેતરમાં શું તમે તમારો મેઈલબોક્સ તપાસ્યો છે? મતદાતા સૂચનાઓ જરી કરવામાં આવી ચૂકી છે!

બ્રમ્પટન, ઓન્ટારિયો – જો તમે બ્રમ્પટન નગરપાલિકા ચૂંટણીના લાયકાત ધરાવતા મતદાર હો, તો કેનેડા પોસ્ટ દ્વારા મોકલાવેલ મતદાતા સૂચના (Voter Notice) માટે તમારો મેઈલબોક્સ જરૂરથી તપાસી લેશો. હાલમાં મતદાતાની સૂચિમાં હોય એવા બધાં જ લોકોને મતદાતા સૂચનાઓ મેઈલ કરવામાં આવી છે. એક તપકીરી રંગનું પરબિડિયુ જેમાં ચૂંટણીની માહિતી અને જે તે સરનામા પર રહેલ પ્રત્યેક મતદાતાને મતદાતા સૂચનાઓ (Voter Notices) મોકલવામાં આવી છે અને આગામી થોડા દિવસોમાં જ તે પ્રાપ્ત થઈ જશે.

મતદાતા સૂચના (Voter Notice) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઓક્ટોબરમાં જ્યારે મત આપવા જવ ત્યારે મતદાતાઓને જાણ કરવામાં આવે છે કે તેઓ પોતાની સાથે ઓળખ આપતો પુરાવો અને મતદાતા સૂચના (Voter Notice) સાથે લઈ જશે.

શું મતદાતા સૂચના (Voter Notice) મળી નથી?

જો તમે મતદાતા સૂચના (Voter Notice) ન મેળવો, તો તમારું નામ મતદાતાની સૂચિમાં નહીં હોય તેવું બની શકે. તમે મતદાતા સૂચિમાં છો કે કેમ તે જાણવા માટે [સીટીની વેબસાઈટ](#) ની મુલાકાત લો.

[સીટીની વેબસાઈટ](#) પર તમે તમારી માહિતી અદ્યતન કરી શકશો અને મતદાતા સૂચિ પર નામ ઉમેરવાની વિનંતી પણ કરી શકશો. મતદાતા સૂચિ પર અપડેટ્સ અને ઓનલાઈન રજિસ્ટ્રેશનો ઓક્ટોબર 13 ના દિને રાતે 11:59 સુધી કરી શકાશે.

શું હું મતદાતા સૂચના (Voter Notice) વિના મત આપી શકું?

હા, ફક્ત યાદ રાખીને તમારું નામ અને લાયકાત પુરવાર કરતો બ્રમ્પટનનું સરનામું ધરાવતો ઓળખનો પુરાવો મતદાન કરવાના સ્થળ પર લઈ જશો. જો તમે મતદાતાની સૂચિ પર નહીં હો, તો મતદાન કરવાના સ્થળ પર તમને સૂચિમાં ઉમેરી શકાશે.

ક્યારે અને ક્યાં મત આપવો?

ઓક્ટોબર 2-4, 6, 9-11, અને 13ના રોજ એડવાન્સ વોટિંગ હાથ ધરાશે. એડવાન્સ વોટિંગ કરવા માટેનું સૌથી નજીકનું સ્થળ શોધવા માટે [અહીં](#) ક્લિક કરો.

ઓક્ટોબર 22 મતદાનનો દિવસ છે. આ દિવસે, તમે તમારા વોર્ડની અંદર કોઈ પણ સ્થળે મત આપી શકશો. તમારા વોર્ડમાં રહેલ સ્થળો તમને [અહીં](#) મળી જશે.

શું તમે મતદાન કરવાના સ્થળ પર પહોંચી શકો તેમ નથી?

તમે કોઈ અન્ય લાયકાત ધરાવતા મતદાતાને (મિત્ર અથવા પરિવારજન) તમારા વતી નિયુક્ત કરી શકો છો. તમારા નિયુક્ત કરેલ પ્રોક્સી મતદાતાએ બ્રમ્પટન સીટી હોલ ખાતે પૂર્ણ કરેલ એપોઈન્ટમેન્ટ ફોર વોટિંગ પ્રોક્સી ફોર્મ (Appointment for Voting Proxy form) રજૂ

કરવાનું રહેશે. પ્રોક્સી ફોર્મ સીટી કલર્સ ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકાશે. પ્રોક્સી દ્વારા મતદાન વિષયક વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક :

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | natalie.stogdill@brampton.ca